

Online preschool TreeHouse launches vocational training courses to make young India future-ready

Ahmedabad, As India gears up to meet the emerging challenge of providing employment to its massive youth population (Young people between 18 and 29 years constitute 22% of India's population), an online learning space is already thinking ahead. TreeHouse, known for borderless pre-school educational modules, will now start virtual livelihood education courses for Class 6 to Class 9 students. From banking, law, e-commerce, aviation and business administration, these courses will cover a gamut of subjects and immerse young minds in skills they need to succeed in an increasingly competitive world.

The curriculum of each of these certified, authentic courses is ready to go and Rajesh adds, "The courses begin with an exploration of basics, discussion of history, and then we dive deep into the teaching of life skills which could be something as basic as writing a cheque, etc or something as advanced as coding. We have also ensured that our faculty constitutes only the best experts in the field."

TreeHouse is the first mover in this space of virtual vocational learning at a time when the New Education Policy underscores the importance of life skills. Founder and CEO, Rajesh Bhatia says, "Rote learning is not enough to make stu-

dents future-ready. They need to learn how the world functions before they join it as contributing adults. If they join the workforce as skilled individuals, the problem of unemployment will be reduced substantially."

Rajesh reminds that even after acquiring formal degrees in B.COM, many young people don't know the basics of filing the NEFT form. He says, "The gap between practical smarts and theoretical understanding is vast and must be bridged. It is important hence to expose students from a young age to actionable knowledge that will hold them in good stead as adults. We have also kept our fees low (at just about Rs 2500) to make it affordable for everyone."

Myntra's latest brand campaign featuring leading fashion icons

Mumbai, In one of India's biggest celebrity-led marketing associations for an e-commerce brand, Myntra has signed up Hrithik Roshan, Vijay Deverakonda and Dulquer Salmaan as its newest brand ambassadors, alongside the existing celebrity ambassadors, Kiara Advani, and Samantha Akkineni, to emphasize its hold on the Indian fashion sphere.

With the combined star power of the most sought-after celebrities from different regions, who are loved and admired for their acting prowess and fashion quotient, Myntra is set to unleash its biggest-ever line up of star-studded brand commercials. These are aimed at targeting consumers across the nation and giving Myntra the opportunity to engage with the fans of these celebrities.

Speaking on the announcement of the new brand ambassadors and the launch of the brand campaign, Harish Narayanan, CMO, Myntra, said, "We are

elated to welcome all the superstars to the Myntra family.

These top fashion icons, who are also acclaimed fashion connoisseurs, will be a part of Myntra's biggest star-studded campaign ever. The campaign will strongly reinforce Myntra's position as 'India's Fashion Expert' with differentiated fashion offerings and unparalleled shopping experience pivoted on technology. This campaign will cut across demographics and build a deeper relationship with our customers across the country."

HrithikRoshan's popularity and global appeal is sure to influence the fashion choices of his huge fan base. His 'Greek God' aspirational persona, the opulent style and fashion choices, his acting and dancing prowess as well as the charisma he exudes are looked up to by millennials and gen-Z, alike and will translate into strengthening Myntra's positioning further, reaching the audience to drive conversations around the over-

all men's wear category.

With back to back blockbuster to his credit and his association with philanthropic initiatives, Vijay Deverakonda's popularity knows no bounds. The brand's partnership with this youth sensation, whose carefree style and unconventional dressing choices, have made him extraordinarily popular. With him on board, Myntra will be able to drive the brand's fashion conversation amongst his constantly growing fan base.

Dulquer's cinematic stronghold, which includes an array of commercially and critically acclaimed movies, along with his mastery in being effortlessly stylish and cool, has earned him quite a following. This association will only make his huge fanbase look out for their favourite actor's wardrobe on Myntra, even more now. Dulquer's charming appeal clubbed with his high fashion quotient will strengthen Myntra's position as the fashion destination of choice.

Hester Biosciences Q1 FY22 Sales have gone up by 50%

Ahmedabad, Leading Animal Healthcare company, Hester Biosciences Ltd reported a standalone net profit of Rs. 12.24 crore for the Quarter ended June 2021 as against net profit of Rs. 7.62 crore in the corresponding period last year - growth of 60%. Revenue from Operations for the Q1FY22 was reported at Rs. 58.51 crore, growth of 50% as compared to Revenue of Rs. 38.88 crore in the corresponding period last year. EPS for Q1FY22 was reported at Rs. 14.38 per share.

The Company achieved an improved operational and financial performance in Q1 FY22 as compared to the corresponding quarter of FY21. EBITDA Margin was reported at 31.02% and Net Profit margin at 20.92% in Q1FY22. The market and economic recovery has supported well for the growth of the poultry and animal industry and is expected to continue in the coming period. The company is con-

stantly investing in the geographical market expansion and marketing manpower to achieve the budgeted topline.

The results of Q1 FY22 have been in line with the financial forecasts and the budgets

During Q1 FY22, the overall topline grew by 50%, compared to Q1FY21 which was affected by a nationwide lockdown during the initial period of the pandemic.

Overall, the sales of Vaccines have registered a growth of 41% in Q1 FY22, and the sale of Health Products have registered a growth of 94% in Q1 FY22.

Domestic sales have registered a growth of 61% in Q1 FY22. The opening up of the domestic market has resulted in the higher demand of the products.

Export sales have registered a marginal de-growth of 8% in Q1 FY22. Export orders are affected due to restricted cargo movements globally.

Grand dad, uncle, brother held for sexually assaulting 7-yr-old girl

Chennai, A 62-year-old person who is the grand father of a seven-year-old girl was arrested by the police after he was accused of sexually assaulting the child.

His son and the girl's 16-year-old brother were also arrested in the case of having assaulted the child on different occasions. The incident occurred at the 62-year-old man's residence at Madippakam near Chennai.

Police said that the grandfather brought his grand children home after his daughter was busy with work and children were having online classes. His son was also staying with him.

The police said that on August 2 at night, grandfather, who was sleeping beside her, sexually assaulted her. Alarmed, the child went

to her uncle's room and in the guise of pacifying her, the man too misbehaved with her. The girl then turned to her 16-year-old brother for help who also sexually assaulted her.

When the girl's mother visited her on Sunday, August 8, she found that the daughter had fallen sick and she took the child to a doctor. The seven-year-old girl narrated the ordeal at the hospital and on medical check-up, it was confirmed that the child was sexually abused. The mother lodged a complaint with the Madippakam all-woman police station. Police registered a case under Pocso Act. Grandfather and her uncle were sent to jail while her 16-year-old brother was sent to a correctional facility.--IANS

OPPO, Spotify to bring personalised playlists for users

New Delhi, Smartphone maker OPPO on Thursday announced its partnership with music-streaming platform Spotify to bring personalised playlists for users that suit their moods and emotions.

The tie-up with Spotify is in keeping with OPPO Reno6 Series cameras that allow users to capture every emotion in portrait with Bokeh Flare Portrait Video in professional-grade quality, the company claimed.

"We are excited to associate with Spotify, the world's largest music streaming app, to deepen our relationship with consumers by providing a personalised listening experience," Damyant Singh Khanoria, Chief Marketing Officer, OPPO India, said in a statement.

"This partnership will allow users to capture their emotions in portrait and listen to their favourite music

curated to their moods. Music transcends boundaries and speaks to your deepest emotions and that is what this personalised playlist is designed to do.

By understanding how exactly you are feeling, it fetches music that truly resonates with you," Khanoria added.

OPPO's partnership with Spotify allows existing users to listen to their favourite songs, along with fresh selections, curated on the basis of moods and emotions. New users are introduced to new playlists and songs that are gradually fine tuned to the listener's tastes.

"We worked with OPPO to bring the power of our personalisation through a first of its kind digital experience to launch the Reno6, where users can get a playlist personalised to their current mood," Arjun Ravi Kolady, Head of Sales, Spotify India.

MG Motor further strengthens the Hector lineup, adds a new Shine variant to the portfolio

Gurugram; To mark the second anniversary of Hector, MG Motor India today added another variant to its lineup MG Hector Shine.

The new trim has an all-new electric sunroof, 17-inch alloy wheels and a 26.4cm HD touchscreen AVN System with Apple CarPlay and Android Auto. Additionally, Shine CVT is equipped with

prizes five variants and gives customers the power of choice. This is an opportunity to welcome new members to the MG family."

Further, MG is also offering a curated accessories package including items of high aesthetic and functional value like leatherette seat covers & steering wheel cover, window sunshades, air purifier, wireless charging, and 3D cabin mats at an attractive price offering. The car will also be backed by MG Shield which is a 5-5-5 offering, including five years of unlimited-kilometre warranty, five years of roadside assistance and five labour-free services.



an electric parking brake, push-button start/stop and smart entry, chrome door handles & telescopic steering.

Commenting on the new trim, Gaurav Gupta, Chief Commercial Officer, MG Motor India, said, "Hector's second anniversary in India is a perfect occasion to further strengthen its portfolio. The addition of the Shine variant braces Hector family range which now com-

Tier-II & Tier-III cities in India are likely to take the Digital india vision forward

Ahmedabad, India's largest crypto currency exchange, WazirX has witnessed 2648% growth in user signups from Tier-II and Tier-III cities of India. The exchange boasts of having over 7.3 Million users, and has clocked over \$21.8 Billion in trading volume in 2021 till date.

Speaking on the development, Nischal Shetty, CEO of WazirX said, "Crypto has immense potential to remove the financial barriers for rural India, and provide cheaper access to capital, more online jobs. At WazirX, our goal is to create a secure crypto ecosystem that takes the vision of Digital India forward by transforming the country into a digitally empowered society and knowledge economy."

As part of the #HumansOfCrypto campaign, speaking about her experience one of the active traders, Anncie said, "Investing through this platform has led to a transformation in many ways for me and my family and

friends. I have learned how to read charts, take calculated risks and earn a decent second income. As far as my family is concerned, I come from a humble background, from South TamilNadu. My folks are well educated but shy away when it comes to taking calculated risks in investing. I introduced WazirX to my clan, especially the women folks who are very good homemakers and have an instinct in managing the finances. Well, I must admit with the clean user interface of WazirX, learning how to deposit, buy and sell was a breeze. I hardly spent a few hours explaining the whole process. And guess what! Now my aunts, uncles, and in-laws give me advice on which alt coins to buy. Crypto has surely brought in a lot of financial inclusiveness in my family."

Tier-II and Tier-III cities have driven almost 55% of total user signups on WazirX in 2021, thereby overtaking Tier-I cities which demonstrated a sign-up growth of 2375%.

According to reports by India's prominent online payment gateway-Razorpay-Tier-II and Tier-III cities contributed to around 54% of digital transactions on its platform in 2020, there by showing a 92% growth in a year. The 7x of cheaper and faster internet clubbed with continuously-lowered smartphone prices have led to rapid internet penetration in the semi-urban cities and rural towns of India.

Interestingly, Tier-II cities like Ahmedabad, Lucknow, Patna have reported an average growth of 2950% whereas Tier-III cities like Ranchi, Imphal, Mohali have reported an average growth of 2455% on WazirX. However, one of the best aspects of the findings was a massive percentage of women from Tier-II and Tier-III cities have joined the crypto bandwagon. Moreover, women from these regions contribute to 65% of the total sign ups by women from all over the country.

MAS Financial Services Ltd reports Rs. 36.83 crore net profit in Q1FY22

Ahmedabad, The Board of Directors of MAS Financial Services Limited (MAS Financial), specialized in MSME financing, announced today the unaudited financial results for the first quarter ended 30th June 2021.

The company has reported a net profit of Rs. 36.83 crore for the Q1FY22 which was at Rs. 36.59 crore in the corresponding quarter last financial year. Total income was at Rs. 148.50 crore for the first quarter in the financial year 2021-22 which was at Rs. 160.40 crore in Q1FY21.

Commenting on the performance, Mr. Kamlesh Gandhi - Founder, Chairman & Managing Director, MAS Financial said, "In consonance with our mission and vision of creating value for stakeholders on a very large scale through efficient last-mile delivery of credit, the main focus of the company continues to remain on maintaining a strong capital base, high level of liquidity, the quality of assets, high provisioning buffers, and constant engagement with all the stakeholders for understanding the evolving

situation. The company's asset under management was at Rs. 5,161.63 crore for the quarter ended on June, 21 which was at Rs. 5,657.73 crore in Q1FY21. A contraction of 8.77% in AUM over the corresponding period of the previous year, due to the adoption of a cautious approach on disbursement while maintaining high collection efficiency.

The total special COVID provision as of 30th June 2021 stood at Rs. 54.27 Crore for the total on book assets of 4047.10 Crores i.e. 1.34%.

Bagrry's launches exciting Superfood Granola range with Belgian Chocolate

Mumbai, To make mornings a delightful experience for us to pull through the entire day, Bagrry's, a pioneering brand in breakfast cereals and health foods, that brought Oats, Muesli and Bran to India has launched the Superfood Granola in two exciting flavors for breakfast.

Aditya Bagri, Director at Bagrry's says, "At Bagrry's, we work with some of the finest natural ingredients from across the world to make wholesome, naturally and innovative breakfast cereals. For over 50 years we've pioneered in bringing the legendary goodness of grains to our consumers. With our new superfood granola range, we've raised the bar in nourishment and indulgence with generously loaded granola with the finest natural superfoods. We've slowly baked this multigrain cereal to give it the perfect crunch along with power packed nutrition. Our granola works well in warm or cold milk, with Greek yoghurt or simply as a snack!"

With their two variants, Bagrry's has both chocolate and fruit lovers covered. The delicious variants are Belgian Dark Chocolate & Almonds Granola and Exotic Fruits with Cranberries & Almonds Granola.

The Belgian Dark Chocolate & Almonds is an enhanced version of a classic double chocolate granola, popular across the globe. With appetizing richness and power-packed superfood goodness in every bite, one gets a wholesome dose of fibre-rich oats, Californian almonds and protein packed quinoa. The granola gets a delicious inclusion with Belgian dark chocolate, whole wheat, and crunchy rice flakes. This granola is made with 5 great grains along with 40% fibre oats and is 100% vegan & plant-based.

The Exotic Fruits with Cranberries & Almonds Granola, is a loaded with the finest fruits from across the world and nuts in one amazing breakfast cereal. Generously indulgent with over 30% fruits and nuts, it has

luscious mangoes, strawberries, bananas, antioxidant rich cranberries, Arabian dates, and Californian almonds.

Having a bowl of Bagrry's superfood granola every morning gives a refreshing and nutrition packed start to the day. The other 40% is full of nourishing oats and protein-rich quinoa. In every single bite, you can feel the natural goodness and extra crunch of this superfood granola.

The Bagrry's breakfast cereal range is natural, fibre rich, innovative, and honestly healthy. At Bagrry's, quality is an obsession, and they strive for the best ingredients from across the world to make into the box of cereals. Bagrry's has been a pioneer in India for introducing categories such as Muesli, Oats, Bran and the range now includes many more healthy foods such as Corn Flakes Plus (with 2X Fibre), Choco+, Whey Protein Muesli, Makhanas, Nut Butters and Superfood range comprising Quinoa, Chia seeds.

This Independence Day, Samsung Extends CSD Benefits to Defence Personnel

Samsung, India's most trusted consumer electronics brand, is celebrating this Independence Day with a brand new initiative for defence personnel. Serving and retired defence personnel can now avail Canteen Stores Department (CSD) rates while buying Samsung TVs and digital appliances such as Air Conditioners, Refrigerators, Microwaves, and Washing Machines from select Samsung SmartPlaza stores as well, in addition to Canteen Stores Department (CSD) depots.

This initiative is aimed at enhancing buying experience and offering a wider range of Samsung products to defence personnel at select Samsung SmartPlaza across the country. Samsung SmartPlaza offers an exclusive and complete range of consumer electronics and Samsung Experience Consultants (SECs) at these stores ensure that consumers get live demos and detailed understanding of product features.

"Keeping in mind the upcoming festive season, Samsung has created one-

of-its-kind initiative by offering CSD benefits at Samsung SmartPlaza to defence personnel and their families. This Independence Day, our endeavour through this program is to create an intimate brand experience by enhancing shopping convenience for them. We hope to continue adding value to their lives with our innovative products and services," said Raju Pullan, Senior Vice President, Consumer Electronics Business, Samsung India. To ensure

consumer and employee safety, all Samsung SmartPlaza follow social distancing and sanitization guidelines. Only a limited number of customers are allowed within the store at any given point to ensure social distancing norms are followed. Customers are encouraged to use digital contactless payments and swiping machines are sanitized before being given to the customer to ensure the highest standards of hygiene is maintained in SmartPlaza.

Olympic champion Chopra rises to second in World Rankings

Mumbai, The gold medal at the Tokyo Olympics javelin throw competition has propelled Indias Neeraj Chopra to move up 14 places to second place in the latest World Athletics Rankings, updated every Wednesday. Chopra, who decimated all the competition in Tokyo to win gold with a throw of 87.58 metres on Saturday, is ranked second at 1395 points behind

Johannes Vetter of Germany. Vetter, the top-ranked German with 1396 points, failed spectacularly in the final at Tokyo and finished ninth. Po'and's Marcin Krukowski is third with 1302 points while Jakub Vadlejch of the Czech Republic, who won the silver medal in Tokyo, is fourth with 1298 points. Julian Weber of Germany is seated in fifth place with 1291 points.

GUJARAT LEASE FINANCING LTD.

(CIN: L65990GJ1983PLC006345)
Regd. Office: 6th Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridge Ahmedabad-380 006.
Ph: 079-26575722, E-mail: gllfho_ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

EXTRACT OF THE STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021

(₹ in Lakhs except per share data)				
Sl. No.	Particulars	Quarter ended 30.06.2021	Year ended 31.03.2021	Quarter ended 30.06.2020
		Un-audited	Audited	Un-audited
1.	Total Income	7.37	2.97	0.62
2.	Total Expenses	15.50	37.88	13.79
3.	Net Profit/(Loss) for the period (before Tax and Extraordinary items)	(8.13)	(34.91)	(13.17)
4.	Net Profit/(Loss) for the period (after Tax and Extraordinary items)	(8.57)	(34.91)	(13.17)
5.	Total Comprehensive Income for the period (after tax)	(8.31)	235.42	78.60
6.	Equity Share Capital	2712.58	2712.58	2712.58
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of the previous year)	-	(3150.61)	-
8.	Earnings Per Share (of ₹ 10/- each)	(0.03)	(0.13)	(0.05)
	Basic and Diluted			

Note: 1. The above is an extract of the detailed financial results for the quarter ended June 30, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes is available on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on Company's website at www.gujaratleasefinancing.co.in.

Place : Ahmedabad
Date : 12th August, 2021

તંત્રી સ્થાનેથી

Editorial....

અમર્યાદિત આચરણ



સંસદનું ચોમાં સુત્ર હંગામા માટે જ વધુ ઓળખાર્થે રહ્યું છે. કદાચ જ કોઈ દિવસ એવો ગયો હશે, જ્યારે સંસદમાં હંગામાને કારણે તેની કાર્યવાહી બાધિત ન થઈ હોય.

આખરે સંસદમાં બોલવાની આ કેવી રીત છે કે ખુરસી-મેજ પર ચડી જવામાં આવે? આ અમર્યાદિત આચરણ એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે કૃષિ કાયદા પર ધ્યાનાકર્ષણ પ્રસ્તાવને અલ્પકાલિક ચર્ચામાં બદલી નાખવામાં આવ્યો.

સાબરમતી-બોધપુર સ્પેશિયલ ટ્રેનના પરિચાલન સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સાબરમતી થી ચાલવાવાળી ટ્રેન નંબર ૦૪૮૨૨ સાબરમતી-બોધપુર સ્પેશિયલ ટ્રેનના મંડળ પર પરિચાલન સમયમાં તકાળ પ્રબાવથી ફેરફાર કરવામાં આવ્યો છે.

સ્પેશિયલ સાબરમતી સ્ટેશન થી ૦૬:૪૦ વાગ્યે ચાલીને ૦૬:૫૨ વાગ્યે ખોડિયાર, ૦૭:૦૪ વાગ્યે કાલોલ, ૦૭:૧૭ વાગ્યે ગુલાસન, ૦૭:૨૨ વાગ્યે ડાંગરવા, ૦૭:૩૪ વાગ્યે આંબલીયાસન તથા ૦૮:૩૦ વાગ્યે મહેસાણા પહોંચીને બોધપુર માટે પ્રસ્થાન કરશે.

હેસ્ટર બાયોસાયન્સિસેFY2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ૬૦ ટકા વધી રૂ. ૧૨.૨૪ કરોડ થયો

અમદાવાદ, ટેશની અગ્રણી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે જૂન, ૨૦૨૧ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૧૨.૨૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના રૂ. ૭.૬૨ કરોડના ચોખ્ખો નફાની સરખામણીએ ૬૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

એએઆમી સમયમાં તે યાહુ રહેશે તેવી શક્યતા છે. અંદાજિત વેચાણ લક્ષ્યાંક હાંસલ કરવા કંપની ભૌગોલિક બજાર વિસ્તારમાં અને માર્કેટિંગ સ્ટ્રાટેજીમાં સતત રોકાણ કરી રહી છે.

એશિયન ગ્રેનિટોએ એસ્ટ્રોન પેપરમાં સમગ્ર હિસ્સો રૂ. ૪૬.૯૪ કરોડમાં વેચ્યો

ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સમાવિષ્ટ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (એચઆઈએલ) તેની એસોસિયેટેડ કંપની એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ્સ લિમિટેડ (એસ્ટ્રોન પેપર)માં તેનો ૧૮.૮૭ ટકાનો સમગ્ર હિસ્સો રૂ. ૪૬.૯૪ કરોડમાં વેચી દીધો છે.

એસ્ટ્રોન પેપર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે આ ગતિવિધિ અંગે જણાવ્યું હતું કે અમારા માટે એ જરૂરી છે કે અમે અમારી મુખ્ય શખતાઓ પર વધુ ધ્યાન આપીએ. એસ્ટ્રોન પેપરમાંથી પોતાનો હિસ્સો વેચવાનો નિષ્ણય નોંધપાત્ર વિકાસ સાથી રહેલા ટાઈલ્સ તથા બિલ્ડિંગ મટિરિયલ્સના મુખ્ય બિઝનેસ પર ધ્યાન આપવાના કારણે છે.

તહેવાર ટાંણે ફરાળી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ અને ત્યારપછી ખાદ્યતેલ સિંગતેલ-કપાસિયામાં થયેલા ભાવ વધારાએ મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખી છે.

ભાડા નહીં પોસાતા ભાગીદારીમાં કોલસ્ટોરેજ બનાવવા તરફ અગ્રેસ થતાં કિસાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે તેમની ઉત્પાદિત ચીજવસ્તુઓનો સંગ્રહ ક્યાં કરવો?? માર્કેટમાં માલનો ભરાવો થાય ત્યારે ઉત્પાદિત થયેલા માલને રાખવો પડે છે.

ભા. જ. પ. માં આગેવાનો-કાર્યકરોને સોંપાયેલી જવાબદારી

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય છે પરંતુ રાજકીય પક્ષોને છેક ઉપરના લેવલથી લઈને ગ્રાઉન્ડ સુધીની તેચરીઓ કરવી પડતી હોવાથી તેઓ ધીમે ધીમે મક્કમાંપૂર્વક રાજકીય અવલોકન કરીને આગળ વધતા હોય છે.

AMC ની લાલીયાવાડી : સરકારે વિકાસના કામો માટે આપેલી ગ્રાન્ટ વણવપરાયેલ રહી

Table with 6 columns: વર્ષ, મળેલ ગ્રાન્ટ, થયેલ ખર્ચ, વણ વપરાયેલ રકમ, જમા બીલ રકમ. Data rows from ૨૦૧૫-૧૬ to ૨૦૨૦-૨૧.

મામલે અધ્યાહાર રહે છે. ૨૦૧૫-૧૬ માં રૂ.૭૮.૮૫ કરોડની ગ્રાન્ટ મળી હતી. જે પૈકી રૂ. ૭૬.૫૫ કરોડની રકમ ખર્ચ થઈ હોવાના દાવા થયા છે. પરંતુ તેની સામે રૂ.૫૮.૮૪ કરોડના બીલ રજૂ થયા છે.

ફરાળી આઈટમના ભાવમાં એકંદરે ૨૦ થી ૩૦ ટકાનો વધારો થયો છે. જો કે જેવી ક્વોલિટીની વસ્તુઓ એવા ભાવ વધ્યા છે. સારી ગુણવત્તાવાળી ફરાળી ખાદ્યચીજવસ્તુ મળતી હોય તેવા સ્ટોર પર ભાવ અલગ હોઈ શકે છે.

ભાડા નહીં પોસાતા ભાગીદારીમાં કોલસ્ટોરેજ બનાવવા તરફ અગ્રેસ થતાં કિસાનો

રૂ.૩૦ થી ૫૦ લાખ સુધીનો ખર્ચ આવતો હોય છે. સુખી સંપત્ત ખેડૂતો આ માર્ગ અપનાવી રહ્યા છે. વળી, સરકાર પણ તેના માટે સબસીડી આપે છે. ડીસા દહેગામ, મોડાસા સહિતના વિસ્તારોમાં ભાગીદારીમાં કોલસ્ટોરેજ બનાવવા થયા છે.

બે પરિવાર ઊંઘમાં જ કાટમાળ નીચે દબાયા

સુરતમાં સરકારી આવાસના મકાન ધરાશાયી: બાળકીનુ મોત

સુરત, સુરતના ઓલપાડના એરથાણ ગામે બે જજરિત સરકારી આવાસ ધરાશાયી થતાં ઘરમાં ઊંઘી રહેલા ૨ પરિવારના સાત લોકો દબાયા, જેમાં ૨ વર્ષની પાયલ નામની બાળકીનું મોત થયું છે.

વિજય સોરઠીયા રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ હતા

વિજય સોરઠીયાના મોતમાં કડક કાર્યવાહીની ઉગ્ર માગ

રાજકોટ, શહેરમાં ગત આઠમી તારીખના રોજ વહેલી સવારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઈકલ સવાર વિજયભાઈ સોરઠીયાને અડફેટે લીધા હતા.

આઠમી તારીખે સવારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઈકલ સવાર વિજય સોરઠીયાને અડફેટે લેતાં મોત થયું અર્થાત્ એક ક્રોડના ભીંખાના આધારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઈકલ સવાર વિજયભાઈ સોરઠીયાને અડફેટે લેતાં મોત થયું અર્થાત્ એક ક્રોડના ભીંખાના આધારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઈકલ સવાર વિજયભાઈ સોરઠીયાને અડફેટે લેતાં મોત થયું

ત્યારે બીઆરટીએસ ટ્રેકમાં પુરપાટ ઝડપે યુવાને સામેથી આવતા જણીતા ઉદ્યોગપતિ કે એવા વિજયભાઈ સોરઠીયા સાઈકલ સહિત અડફેટે લેતા વિજયભાઈ સોરઠીયા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બે પરિવાર ઊંઘમાં જ કાટમાળ નીચે દબાયા

સુરતમાં સરકારી આવાસના મકાન ધરાશાયી: બાળકીનુ મોત

સુરત, સુરતના ઓલપાડના એરથાણ ગામે બે જજરિત સરકારી આવાસ ધરાશાયી થતાં ઘરમાં ઊંઘી રહેલા ૨ પરિવારના સાત લોકો દબાયા, જેમાં ૨ વર્ષની પાયલ નામની બાળકીનું મોત થયું છે.

પડયા ત્યારે બે આવાસમાં આદિવાસી પરિવારો ઊંઘી રહ્યા હતા. બંને પરિવારના સાત લોકો દીવાલ નીચે દબાઈ ગયા હતા.

Company information for JAYATMA INDUSTRIES LIMITED including Regd. office, website, and contact details.

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2021

Financial results table with columns: Sr. No., PARTICULARS, Quarter Ended 31-June-2021, Quarter Ended 31-June-2020, Year Ended 31-Mar-2021. Rows include Total income, Net Profit, etc.

Note: Note: The above is an extract of the detailed format of quarterly Financial Result filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

By Order of the Board For, J ayatma Industries Limited

માસ ફાયનાન્સિયલ નો નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. ૩૬.૮૩ કરોડ થયો

એમએસએમઈ ફાયનાન્સિંગના ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ૩૦ જૂન, ૨૦૨૧ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે.

જૂન, ૨૦૨૧ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે કંપનીની એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. ૫,૧૬૧.૬૩ કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. ૫,૬૫૦.૭૩ કરોડ હતી.

Table with 4 columns: SL. No., Particulars, Quarter ended 30.06.2021, Year ended 31.03.2021, Quarter ended 30.06.2020. Rows include Total Income, Total Expenses, etc.